



જનસંપર્ક અધીકારી દ્વારા

પોલીસ કમિશનરશ્રીની કચેરી, અમદાવાદ શહેર

ટેલીફોન નંબર ૨૫૬૩૩૩૩૩



કંટ્રોલરૂમ ટેલી.નં. ૨૫૬૩૦૧૦૦, ૨૫૬૩૦૨૦૦, ૨૫૬૩૦૪૦૦ ફેક્સ: ૨૫૬૩૦૬૦૦

તા.૦૭/૦૯/૨૦૧૯ શનિવાર

અમદાવાદ શહેર પોલીસ સમાચાર

નશાબંધી તથા જુગાર ધારા હેઠળ ઝડપાયા:-

સમાચાર યાદી નં.૧૫૦૭/૧૯

શહેર પોલીસે ગઈકાલે નશાબંધી ધારા હેઠળ ૪૫ કેસ કરી, ૪૪ વ્યક્તિઓને ઝડપી, ૫૨૪ લીટર દેશી દારૂ, ૧૨૦ બોટલ ઇંગ્લીશ દારૂ, ૧૨ ક્વાર્ટર ઇંગ્લીશ દારૂ, ૨૪ બિયર ટીન, ૧ કાર અને ૧ સ્ફૂટર કબજે કર્યું હતું. તેમજ જુગાર ધારા હેઠળ ૨ કેસ કરી ૨ વ્યક્તિઓને ઝડપી રોકડ રૂપિયા ૨૨૬૦/- અને જુગારના સાધનો કબજે કર્યા હતા.

તકેદારીના પગલા હેઠળ ઝડપાયા:-

સમાચાર યાદી નં.૧૫૦૮/૧૯

શહેર પોલીસે ગઈકાલે તકેદારીના પગલા હેઠળ સી.આર.પી.સી.૧૦૭,૧૦૯,૧૧૦,૧૫૧ મુજબ કુલ ૬૭ વ્યક્તિઓની અટકાયત કરી હતી. તેમજ પ્રો.હી.૯૩ મુજબ ૧ વ્યક્તિની અને પાસા હેઠળ ૮ વ્યક્તિઓની અટકાયત કરી હતી.

વિશ્વાસઘાત અને છેતરપીંડી :-

સમાચાર યાદી નં.૧૫૦૯/૧૯

કાલુપુર: રાકેશભાઈ ધીરુભાઈ વાળાકી (રહે. આયુષી એલીગન્સ મનમોહન પાર્ક રોડ વિરાટનગર રોડ નિકોલ) એ તા.૦૬/૦૯/૧૯ નારોજ કાલુપુર પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ નોંધાવી છે કે તા.૨૨/૦૧/૧૯ થી આજદીન સુધીના સમયગાળા દરમિયાન આરોપી વિમલ પ્રજાપતિ ઉર્ફે નિંકુજ પરમાર (રહે. દુકાન નંબર-૮ ફસ્ટ ફ્લોર અમર જ્યોત શોપીંગ સેન્ટર ઇન્દ્રા કોમ્પ્લેક્ષ પાસે સ્પંદન સર્કલ માંજલપુર વડોદરા) કાલુપુર ગાંધીરોડ કોઠારી પોળની અંદર જી.આર.કોમ્પ્લેક્ષ ખાતે દુકાન નં-૧૦૪ શિવ ટ્રેડીંગ નામની કંપનીમાંથી અલગ-અલગ સાઇઝના ઇલેક્ટ્રિક કેબલનો માલ લઈ જઈ બાકી નિકળતા નાણાં ૩,૧૦,૪૪૪/- નહી ચુકવી વિશ્વાસઘાત અને છેતરપીંડી કરી છે. આ ગુનાની તપાસ પો.સ.ઈ.શ્રી એમ.જી.વસાવા ચલાવે છે.

ઘરફોડ :

સમાચાર યાદી નં.૧૫૧૦/૧૯

વસ્ત્રાપુર: નારણભાઈ વરવાભાઈ દેસાઈ (ઉ.વ.૩૫) (રહે.જાનકી એપાર્ટમેન્ટ બીજો માળ બોડકદેવ) એ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ નોંધાવી છે કે તા.૦૬/૦૯/૧૯ સાજના ૬/૩૦ થી ૮/૦૦ વાગ્યા દરમિયાન પોતાના મકાનના દરવાજાનું તાળુ તોડી અજાણી વ્યક્તિ ઘરમાં પ્રવેશ કરી સોનાનું મંગળસુત્ર કિંમત રૂપિયા ૫૦,૦૦૦/-, સોનાની બુટ્ટી એક જોડ કિંમત રૂપિયા ૫૦,૦૦૦/-, સોનાની ચેઇન કિંમત રૂપિયા ૪૦,૦૦૦/-, સોનાની લકી કિંમત રૂપિયા ૫૦,૦૦૦/- અને રોકડ રૂપિયા ૧,૬૦,૦૦૦/- મળી કુલ રૂપિયા ૩,૫૦,૦૦૦/- મતાની ચોરી કરી લઈ ગઈ છે. આ ગુનાની તપાસ પો.ઈ.શ્રી એસ.આર.ગામીત ચલાવે છે.

મેઘાણીનગર: રમેશભાઈ કાલીદાસ પરમાર (રહે. ઓમનગર સોસાયટી મેઘાણીનગર) એ મેઘાણીનગર પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ નોંધાવી છે કે તા.૦૫/૦૯/૧૯ રાતના ૧૧/૦૦ થી તા.૦૬/૦૯/૧૯ સવારના ૬/૦૦ વાગ્યા દરમિયાન પોતાના મકાનમાં અજાણી વ્યક્તિ પ્રવેશ કરી મોબાઈલ ફોન નંગ-૨ કિંમત રૂપિયા ૧૦,૦૦૦/- , રોકડ રૂપિયા ૭,૦૦૦/- તેમજ ઘરની બહાર પાર્ક કરેલ પોતાનું એક્ટીવા નંબર જીજે ૦૧ યુડી ૫૫૫૩ કિંમત રૂપિયા ૩૦,૦૦૦/- ચોરી કરી લઈ ગઈ છે. આ ગુનાની તપાસ પો.સ.ઈ.શ્રી એ.એન.પરમાર ચલાવે છે.

આત્મહત્યા:-

સમાચાર યાદી નં.૧૫૧૧/૧૯

માધવપુરા: લતાબહેન વા/ઓફ કિશોરભાઈ સાગઠીયા (ઉ.વ.૩૭) (રહે. હિરાજી દેવાજીની ચાલી ધોબીઘાટ કંપાઉન્ડના છાપરાં માધવપુરા) એ બિમારીથી કંટાળી તા.૦૬/૦૯/૧૯ સાજના ૫/૦૦ વાગ્યાના સુમારે પોતાના ઘરે એસીડ પી લેતા સારવાર માટે સીવીલ હોસ્પિટલ લઈ જતા ફરજ પરના ડૉશ્રીએ મૃત જાહેર કર્યા હતા. આ અંગે માધવપુરા પોલીસે અકસ્માત મોત નોંધી આ અંગેની તપાસ પો.સ.ઈ.શ્રી એ.એન.પટેલ ચલાવે છે.

સેટેલાઈટ: ભારતી પુરાભાઈ સોલંકી (ઉ.વ.૨૦) (રહે. દેવમોડાનો વાસ ગુલબાઈ ટેકરા નવરંગપુરા) એ અગમ્ય કારણસર તા.૦૬/૦૯/૧૯ નારોજ સેટેલાઈટ પાયલપાર્ક ખાતે છતમાં હિંચકાના હુકમાં દુપટ્ટો બાંધી ગળેફાસો ખાઈ આત્મહત્યા કરી હતી. આ અંગે સેટેલાઈટ પોલીસે અકસ્માત મોત નોંધી આ અંગેની તપાસ પો.સ.ઈ.શ્રી એમ.જી.લિંબોલા ચલાવે છે.

નારોલ: સમાબાનુ ડો/ઓફ અનવરખાન પઠાણ (ઉ.વ.૧૯) (રહે. નજરપાર્ક સોસાયટી અલીફનગરની બાજુમાં નારોલ) એ અગમ્ય કારણસર તા.૦૫/૦૯/૧૯ સાજના ૫/૪૫ વાગ્યા પોતાના ઘરે પોતાની જાતે પોતાના શરીર ઉપર કેરોસીન છાંટી સળગી ગયા હતા. સારવાર માટે એલ.જી.હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન તા.૦૬/૦૯/૧૯ કલાક ૦૦/૩૦ વાગે તેમનું મૃત્યુ નિપજયુ હતુ.આ અંગે નારોલ પોલીસે અકસ્માત મોત નોંધી આ અંગેની તપાસ નારોલ પોલીસ ચલાવે છે.

નાયબ પોલીસ કમિશનર,
કંટ્રોલરૂમ, અ'વાદ શહેર.
પોલીસ કમિશનર વતી.